

માનનીય મુખ્યમંત્રીશ્રી શિષ્યવૃત્તિ યોજના

શિષ્યવૃત્તિ રીન્યુઅલ માટેની સુચનાઓ

1. શૈક્ષણિક વર્ષ ૨૦૧૪-૧૫ માં માન. મુખ્યમંત્રીશ્રી શિષ્યવૃત્તિ યોજના અન્વયે જે વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવેલ છે એ વિદ્યાર્થીઓએ બીજા વર્ષની શિષ્યવૃત્તિ રીન્યુઅલ માટે ઓનલાઇન અરજી કરવાની રહે છે.
 2. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ : ૨૦/૦૧/૨૦૧૬ છે.
 3. શિષ્યવૃત્તિ રીન્યુઅલ માટે ઓનલાઇન અરજીઓ મંગાવતી જાહેરાત રાજ્યના અગ્રગણ્ય દૈનિકપત્રોમાં તા. ૨૧/૧૨/૨૦૧૫ ના રોજ પ્રસિધ્ધ થયેલ છે.
 4. માન. મુખ્યમંત્રીશ્રી શિષ્યવૃત્તિ યોજના અન્વયે વિદ્યાર્થીઓએ પ્રથમ વર્ષે જે પ્રમાણે ઓનલાઇન અરજી કરી હતી તે જ વેબપોર્ટલ પર શિષ્યવૃત્તિ રીન્યુઅલ માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે.
 5. આ માટે વિદ્યાર્થીઓએ પ્રથમ વર્ષે આપવામાં આવેલ **User-ID** (HSC Seat No) અને **Password** નો ઉપયોગ કરી લોગઇન થવાનું રહેશે. જે વિદ્યાર્થીઓને **Password** યાદ ન હોય તેવા કિસ્સામાં **Forgot Password** ની મદદથી રજીસ્ટર્ડ મોબાઇલ પર નવો Password મેળવી શકાશે.
 6. વિદ્યાર્થીઓએ ઓનલાઇન અરજી કર્યા બાદ હેલ્પ સેન્ટર ખાતે અસલ દસ્તાવેજોની ચકાસણી કરાવી એક સેટ જમા કરાવવાનો રહેશે.
 7. 'મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના' અન્વયે નિયુક્ત કરવામાં આવેલ તમામ ૯૧ હેલ્પ સેન્ટરોને માન. મુખ્યમંત્રીશ્રી શિષ્યવૃત્તિ યોજના અન્વયેની બીજા વર્ષની રીન્યુઅલ શિષ્યવૃત્તિની અરજીઓની ચકાસણી સંબંધિત તમામ કામગીરી માટે પણ નિયુક્ત કરવામાં આવેલ છે.
 8. શૈક્ષણિક સંસ્થાના નીતિ નિયમો પ્રમાણે ગંભીર ગેરશિસ્ત વિષયક કોઈપણ કાર્યવાહી કરવામાં આવેલ નથી તથા પ્રથમ વર્ષ દરમિયાન ૭૫ % કે તેથી વધુ હાજરી આપેલ છે તથા અન્ય કોઈ શિષ્યવૃત્તિ મેળવતા ન હોવાનું અને પ્રથમ વર્ષમાં મેળવેલ પરિણામ દર્શાવતું સંસ્થાના વડાનું પ્રમાણપત્ર અસલમાં વિદ્યાર્થી દ્વારા શિષ્યવૃત્તિ રીન્યુઅલ માટે રજૂ કરવાનું રહેશે. સંસ્થાના લેટર હેડમાં રજૂ કરવાનું થતા આ પ્રમાણપત્રનું ફોર્મેટ વેબપોર્ટલ પર ઉપલબ્ધ છે.
 9. માન. મુખ્યમંત્રીશ્રી શિષ્યવૃત્તિ યોજનાના લાભાર્થી વિદ્યાર્થીઓની વિગતો આધાર કાર્ડ સાથે લીંક કરવાની હોવાથી વિદ્યાર્થીઓએ આધારકાર્ડ નંબર આપવાનો રહેશે.
 10. શિષ્યવૃત્તિ રીન્યુઅલ માટે વિદ્યાર્થીએ નીચેના દસ્તાવેજો જોડવાના રહેશે.
 1. સંસ્થાના વડા પાસેથી શિષ્યવૃત્તિ રીન્યુઅલ માટેનું પ્રમાણપત્ર (અસલમાં)
 2. વિદ્યાર્થીના પ્રથમ વર્ષની માર્કશીટની નકલ (સેમેસ્ટર સીસ્ટમ હોય તો બન્ને સેમેસ્ટરની માર્કશીટ)
 3. વિદ્યાર્થીએ સ્નાતક અભ્યાસક્રમના બીજા વર્ષમાં ફી ભર્યાની પહોંચ
 4. વિદ્યાર્થીના બેન્કના બચત ખાતાની પાસબુકનું પ્રથમ પાનું
 5. વિદ્યાર્થીના આધારકાર્ડની નકલ
- ઓનલાઇન અરજી સંબંધિત કોઈપણ પ્રકારની મુંઝવણ માટે cmssgujarat@gmail.com પર ઈ-મેલ કરવો.